

# રાજકોટ મહાનગરપાલિકા

ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

:- અખબારી યાદી:-

રાજકોટના વિવિધ અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકોને પોતાનું અને પોતાના પરિવારનાં સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવવા મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીની અપીલ

શ્રમિકો તા.૦૪-૦૩-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૩ દરમ્યાન ત્રણેય ઝોનના મિટિંગ રૂમ ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે

તા.૦૪-૦૩-૨૦૨૩

કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમા કામ કરતા તમામ કામદારો/શ્રમિકો પોતાનું અને પોતાના પરિવારના સભ્યોનું ઈ-શ્રમ કાર્ડ માટેનું રજિસ્ટ્રેશન કરાવી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીનું વિમા કવચ મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા તમામ શ્રમિકોને સત્વરે રજિસ્ટ્રેશન કરાવી લેવા મેયરશ્રી ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

ઈ-શ્રમનાં રજિસ્ટ્રેશન માટે ૧૬ વર્ષથી ૬૦ વર્ષ સુધીની વય હોવી જોઈએ. તેમજ EPFO / ESIC- કામદાર રાજ્ય વીમા યોજનાના સભ્ય ન હોય અને આવક વેરો ચુકાવતા ન હોય તેવા તમામ શ્રમિકો ઈ-શ્રમ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ રજિસ્ટ્રેશન માટે શ્રમિકો તથા પરિવારના સભ્યોના મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર તેમજ બેંક ખાતાની વિગતો તથા નોમિનીની વિગતોની જરૂરીયાત રહેશે.

ખાસ નોંધ :

ઈ-શ્રમ કાર્ડ કઢાવવા ઇચ્છતા નાગરિકે નીચે મુજબના ડોક્યુમેન્ટસ પોતાની સાથે રાખવાના રહેશે.

1. બેંક પાસબુક
2. આધાર કાર્ડ

૩. આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર.

જે નાગરિકે અગાઉ ઇ-શ્રમ કાર્ડ કઢાવેલ હોઈ તેને ફરીથી ઇ-શ્રમ કાર્ડ કઢાવવાનું રહેતું નથી. સિસ્ટમમાં તેમનો ડેટા પહેલેથી જ હોઈ બીજી વાર રજીસ્ટ્રેશન થઈ શકશે નહિ.

આ અંગે રજીસ્ટ્રેશન તા.૦૪-૦૩-૨૦૨૩ થી તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી નીચેના સ્થળે કચેરીના કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૦:૩૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી કરી શકાશે..

(૧) મીટીંગ રૂમ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઓન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા,  
ડૉ. આબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ.

(૨) મીટીંગ રૂમ, પ્રથમ માળ, પૂર્વ ઓન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા,  
ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, ભાવનગર રોડ, રાજકોટ.

(૩) મીટીંગ રૂમ, પ્રથમ માળ, પશ્ચિમ ઓન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા,  
હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, બિગ બજાર પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ.

(પી.એ.ટુ મેયર)